

## ઋણ સ્વીકાર

સંશોધન એક સહિયારા પ્રયત્નોથી હાથ ધરાતી પ્રવૃત્તિ છે. આથી સંશોધકને સંશોધનક્ષેત્રે ઊંડી સૂઝ ધરાવતા માર્ગદર્શકના અમૂલ્ય સૂચનો પ્રાપ્ત થાય તો જ આ સંશોધનકાર્ય પૂર્ણ કરી શકે. મારા આ શોધકાર્યમાં માર્ગદર્શકની ભૂમિકા પૂરી પાડનાર, યોગ્ય દિશાસૂચન અને પ્રેરણા પૂરી પાડનારા માર્ગદર્શક અને વંદનીય ગુરુજી ડૉ.પ્રેમાભાઈ એસ. પટેલ એ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને મારાં સંશોધનકાર્યમાં આરંભથી અંત સુધી ઉત્સાહથી અને ઝીણવટપૂર્વકનું સતત માર્ગદર્શન પુરું પાડ્યું છે. માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે જ તેમના ધર્મપત્ની શારદા બહેનને આદરપૂર્વક યાદ કરું છું.

આ ક્ષણે મને સાહિત્ય સાથે સંચાર કરાવનારા મારા ગુરુ ઉષાબહેન ઉપાધ્યાયને તહે દિલથી યાદ કરું છું. સાથે સતત પ્રત્યક્ષ કે પરોક્ષ રહીને સહકાર આપવા બદલ પ્રસાદ બ્રહ્મભટ્ટ સરનો આભાર માનું છું. આ સાથે મને કોલેજકાળ દરમિયાન શિક્ષણ આપનાર જગદીશ ગુજ્જર, નરેશ વાઘેલા, વર્ષાબહેન પટેલ વગેરે આ ક્ષણે સાંભળે છે.

સૌપ્રથમ પોતાના કુળને દીપાવનાર દીકરી 'ડૉક્ટર'ની પદવી પ્રાપ્ત કરે એવા આશીર્વાદ આપનાર પૂજ્ય પિતાશ્રી કનુભાઈ અંબાલાલ પટેલ અને માતાશ્રી નિકેતાબહેન પટેલની આ જન્મ ઋણી છું. આ શોધ નિબંધને તૈયાર કરવામાં આરંભથી અંત સુધી પર્યંત મારા ઉત્સાહને ટકાવી રાખનાર અને મારો નિબંધ ઉત્કૃષ્ટ રીતે પૂર્ણ થાય એવા મનોરથ સેવનાર અનુજ ભાઈશ્રી પ્રસિદ્ધ પટેલ પણ પ્રેરકબળ બન્યા છે.

આ મહાશોધ નિબંધને તૈયાર કરવામાં ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથપાલશ્રીની મોટી મદદ મળી છે. મને ઉપયોગી એવા સંદર્ભે ગ્રંથો માટે મદદરૂપ થનારા ગ્રંથાલયના સેવક મિત્રોનો પણ આભાર માનું છું. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથપાલ તેમજ સેવક ગણનો અત્રે આભાર વ્યક્ત કરું છું.

સંશોધનક્ષેત્ર કાર્ય કરતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર સહાનુભૂતિપૂર્વક સહકાર આપનાર વડિલો તેમજ સહાધ્યાયી મિત્રો તથા નિબંધને સુવ્યવસ્થિત અને સમયસર ટાઈપ કરી આપવા બદલ ભારતીબહેન લેઉવાનો પણ અત્રે આભાર વ્યક્ત કરું છું.

અનોખી કનુભાઈ પટેલ